

(A-31)

SEAT

SARDAR PATEL UNIVERSITY  
 F.Y. B.Com. (EXTERNAL) EXAMINATION (OLD)  
 MONDAY, 8<sup>th</sup> APRIL,  
 2019

02.00 P.M. TO 05.00 P.M.

BM-101: BUSINESS MATHEMATICS

**Total Marks: 100**

- Q.1** [A] Define with example [06]  
 1. Matrix 2. Square Matrix 3. Identity Matrix
- [B] Solve the following equations by using Cramer's rule: [06]  
 $2x + y = 4, 5x + 3y = 9.$
- [C] If  $A = \begin{bmatrix} 4 & -1 \\ -1 & 3 \\ 2 & 0 \end{bmatrix}$ ,  $B = \begin{bmatrix} -2 & 5 \\ 3 & -1 \\ 5 & 2 \end{bmatrix}$  and  $C = \begin{bmatrix} 2 & 4 \\ -1 & -5 \\ 3 & -2 \end{bmatrix}$  [08]  
 Find (i)  $A + B$  (ii)  $A + B + C$

OR

- Q.1** [A] Explain rules of determinant. [06]
- [B] If  $A = \begin{bmatrix} 4 & 1 \\ 5 & 3 \end{bmatrix}$  and  $B = \begin{bmatrix} 1 & 2 \\ 3 & 1 \end{bmatrix}$ , find  $A^2 + B^2$ . [06]
- [C] Find the value of  $\begin{vmatrix} 4 & 2 & -3 \\ 4 & 3 & -5 \\ 4 & -3 & -1 \end{vmatrix}$  [08]

- Q.2** [A] Evaluate the following. [12]
- i.  $\lim_{x \rightarrow -2} \frac{x^2 - 4}{x + 2}$
- ii.  $\lim_{x \rightarrow 3} \frac{x^2 + 2x - 15}{x^2 - 9}$
- iii.  $\lim_{x \rightarrow 0} \frac{2^x - 3^x}{x}$
- [B] Draw Venn Diagram of the following. [08]  
 (i)  $A'$  (ii)  $A \cup B$  (iii)  $A \cap B$  (iv)  $(A - B)$

OR

- Q.2** [A] Define with example. [06]  
 I. Finite Set  
 II. Intersection  
 III. Symmetric difference
- [B] If  $A = \{a, b, c, d\}$  then find the power set of A. [06]

- [C] State De Morgan's laws for two sets A and B and verify them by taking  $U = \{1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10\}$ ,  $A = \{1, 2, 4, 6, 8\}$  and  $B = \{2, 3, 6, 7, 9\}$ . [08]

- Q.3**
- [A] Find the maximum and minimum values of the following function.  $f(x) = x^3 + x^2 - x + 1$  [05]
  - [B] Find the equilibrium price using following demand and supply function.  $d = 20 - 4p$ ,  $s = 10p - 8$  [05]
  - [C] Differentiate w.r.t.  $x$ ,  $y = 5^x \log x$  [05]
  - [D] Find derivative of the function  $y = \sqrt{x}$  using the definition of derivative. [05]

**OR**

- Q.3**
- [A] Write rules of derivative. [05]
  - [B] At which point the function  $f(x) = x^2 - 2x + 5$  is minimum? Find the minimum value of  $f(x)$ . [05]
  - [C] Find  $\frac{dy}{dx}$ , if  $y = t^2 + t + 1$ ,  $x = 2t + 1$  [05]
  - [D] Find  $\frac{dy}{dx}$ , If  $y = x^3 - 3x^2 + 4x + 9$  [05]

- Q.4**
- [A] Define the following,  
(i) Objective function (ii) Feasible solution (iii) Optimum solution. [06]
  - [B] Find  $a$  if the distance between  $(-3, -2)$  and  $(a, 1)$  is  $3\sqrt{10}$ . [06]
  - [C] Use the graphical method to solve the following LPP.  
 $Max Z = 3x_1 + 5x_2$   
Subject to  $3x_1 + 2x_2 \leq 18$ ,  
 $x_1 \leq 4$ ,  
 $x_2 \leq 6$ ,  $x_1, x_2 \geq 0$  [08]

**OR**

- Q.4**
- [A] Show that the equation of a line having slope  $m$  and Y- intercept  $c$  is  $y = mx + c$ . [06]
  - [B] Obtain the equation of a line passing through the points  $(-1, 2)$  and  $(5, -3)$ . Find its slope and intercepts on the axes. [06]
  - [C] Solve following LPP by graphical method:  
 $Maximise Z = 300x + 200y$   
Sub. to  $x + y \leq 50$ ,  $2x + y \leq 80$ .  $x, y \geq 0$  [08]

- Q.5**
- [A] Sanket Limited fixes a target of producing 60,000 tons at the end of 7 years. If the production grows at a rate of 5% per annum, find the present day production of the company. [06]

- [B] Bharat Travels Private Ltd. Purchased a mini-bus worth Rs. 4, 50,000. Its [06]  
 expected life is 5 years. It is estimated that after 5 years, the price of the  
 mini-bus will increase by 20%. To buy a new mini-bus, it has been decided  
 to create a sinking fund and invest it at 12% rate of compound interest.  
 Find the sum to be transferred to the sinking fund on 31<sup>st</sup> December of  
 every year.
- [C] Determine the minimum time for the given assignment problem. [08]


	Jobs				
		I	II	III	IV
Machine	A	42	40	51	67
	B	57	42	63	58
	C	49	52	48	61
	D	41	45	60	55

OR

- Q.5 [A] Define the terms: (i) Simple interest (ii) Annuity (iii) Sinking Fund [06]  
 [B] Hiteshbhai deposited Rs. 15,000 with a leasing company at 11% rate of  
 compound interest. What amount will he receive at the end of 5 years? How  
 much interest will he get? [06]  
 [C] Solve the following minimal assignment problem: [08]

Persons	Job				
	P	Q	R	S	T
A	6	12	11	3	5
B	4	2	7	1	10
C	8	11	10	7	11
D	16	19	12	23	21
E	9	5	7	6	10

(3)



(A-21)  
(vii).

**SEAT No. \_\_\_\_\_**  
**SARDAR PATEL UNIVERSITY**  
**F.Y. B.Com. (EXTERNAL) EXAMINATION (OLD)**  
**MONDAY, 8<sup>th</sup> APRIL,**  
**2019**  
**02.00 P.M. TO 05.00 P.M.**  
**BM-101: BUSINESS MATHEMATICS**

કુલ ગૂણ: 100

**Q.1 [A]** ઉદાહરણ સાથે વ્યાખ્યા લખો. [06]

1. શ્રેષ્ઠિક      2. ચોરસ શ્રેષ્ઠિક      3. એકમ શ્રેષ્ઠિક

**[B]** નિચેના સમીકરણો કેમરની રીતે ઉકેલો: [06]

$$2x + 5y = 4 \text{ અને } 3x - 2y = 7$$

**[C]** જો  $A = \begin{bmatrix} 4 & -1 \\ -1 & 3 \\ 2 & 0 \end{bmatrix}$ ,  $B = \begin{bmatrix} -2 & 5 \\ 3 & -1 \\ 5 & 2 \end{bmatrix}$  અને  $C = \begin{bmatrix} 2 & 4 \\ -1 & -5 \\ 3 & -2 \end{bmatrix}$  [08]  
હોય તો (i)  $A + B$    (ii)  $A + B + C$  શોધો.

**OR**

**Q.1 [A]** નિશ્ચાયકના નિયમો લખો. [06]

**[B]** જો  $A = \begin{bmatrix} 4 & 1 \\ 5 & 3 \end{bmatrix}$  અને  $B = \begin{bmatrix} 1 & 2 \\ 3 & 1 \end{bmatrix}$ , હોય તો  $A^2 + B^2$  શોધો. [06]

**[C]** કુમત શોધો  $\begin{vmatrix} 4 & 2 & -3 \\ 4 & 3 & -5 \\ 4 & -3 & -1 \end{vmatrix}$  [08]

**Q.2 [A]** કુમત શોધો. [12]

i.  $\lim_{x \rightarrow -2} \frac{x^2 - 4}{x + 2}$

ii.  $\lim_{x \rightarrow 3} \frac{x^2 + 2x - 15}{x^2 - 9}$

iii.  $\lim_{x \rightarrow 0} \frac{2^x - 3^x}{x}$

**[B]** વેન આફ્ટિઓ દોરો. [08]

- (i)  $A'$    (ii)  $A \cup B$    (iii)  $A \cap B$    (iv)  $(A - B)$

**OR**

**Q.2 [A]** વ્યાખ્યા આપો: i.) ગણી નિયમો. ii.) સાનત ગણી નિયમો. iii.) સંમિત તફાવત

[06]

**[B]** ગણી  $A = \{a, b, c, d\}$  નો ઘાતગણી શોધો. [06]

**[C]** દી મોર્ગનના નિયમો લખો અને નીચે આપેલા ગણી A અને B ની મદદથી ચકાસો. [08]

$$U = \{1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10\}, A = \{1, 2, 4, 6, 8\} \text{ અને } B = \{2, 3, 6, 7, 9\}.$$

- Q.3** [A] જો  $f(x) = x^3 + x^2 - x + 1$  હોયતો,  $f(x)$  ની મહત્વમ અને ન્યુનત્વમ કિંમત શોધો. [05]  
[B] નીચે આપેલા માંગ અને પુરવણા વિધેયો પરથી બજાર સમતોલ કિંમત શોધો. [05]  

$$d = 20 - 4p, \quad s = 10p - 8$$
  
[C]  $y = 5^x \cdot \log x$  નું  $x$  ની સાપેક્ષ વિકલન કરો. [05]  
[D] વ્યાખ્યાની મદદથી  $f(x) = \sqrt{x}$  વિધેયનું વિકલન શોધો. [05]

OR

- Q.3** [A] વિકલનના નિયમો લખો. [05]  
[B]  $x$  ની કઈ કિંમત આગળ  $f(x) = x^2 - 2x + 5$  ની કિંમત ન્યુનત્વમ થાય?  $f(x)$  ની ન્યુનત્વમ કિંમત શોધો. [05]  
[C] જો  $y = t^2 + t + 1, \quad x = 2t + 1$  હોયતો  $\frac{dy}{dx}$  શોધો [05]  
[D] જો  $y = x^3 - 3x^2 + 4x + 9$  હોયતો  $\frac{dy}{dx}$  શોધો [05]
- Q.4** [A] નીચેના પદો વ્યાખ્યિત કરો.. [06]  
1. હેતુલક્ષી વિધેય      2. શક્ય ઉકેલ      3. ઈષ્ટત્વમ ઉકેલ.  
[B] જો  $(-3, -2)$  અને  $(a, 1)$  બિંદુઓ વચ્ચેનું અંતર  $3\sqrt{10}$  હોયતો  $a$  શોધો. [06]  
[C] આલેખની મદદથી નીચેનો પ્રશ્ન ઉકેલો.  
 $Z = 3x_1 + 5x_2$  ને નીચેની શરતો ને આધીન મહત્વમ બનાવો.

$$\begin{aligned} 3x_1 + 2x_2 &\leq 18, \\ x_1 &\leq 4, \\ x_2 &\leq 6, \quad x_1, x_2 \geq 0 \end{aligned}$$

OR

- Q.4** [A] સાબિત કરોકે  $m$  ઢાળવાળી અને  $y$ -અક્ષ પરનો અંતઃખંડ  $c$  હોય તેવી રેખાનું સમીકરણ [06]  
 $y = mx + c$  છે.
- [B] બિંદુઓ  $(-1, 2)$  અને  $(5, -3)$  માંથી પસાર થતી રેખાનું સમીકરણ, ઢાળ અને અંતઃખંડો શોધો. [06]  
[C] આલેખની મદદથી નીચેનો પ્રશ્ન ઉકેલો.  
 $Z = 300x + 200y$  ને નીચેની શરતો ને આધીન મહત્વમ બનાવો.  
 $x + y \leq 50, \quad 2x + y \leq 80, \quad x, y \geq 0$

- Q.5** [A] સંકેત લીમિટેડ 7 વર્ષના અંતે ઉત્પાદન લક્ષ 60,000 ટન નક્કી કર્યું છે. જો ઉત્પાદનમાં 62 વર્ષે 5% નો વધારો થતો હોય તો, કંપનીનું હાલનું ઉત્પાદન શોધો. [06]

- [B] ભારત ટ્રાવેલ્સ લીમિટેડ રૂ. . 4, 50,000 ની એક મિની બસ ખરીદે છે . તેનું અંદાજીત આયુષ્ય [06]  
 5 વર્ષનું છે. તે પછી નવી મિની-બસ ખરીદવા માટે હાલના કરતા 20 ટકા વધુ રકમ ચૂકવવી  
 પડશે તેવો અંદાજ છે. નવી મિની-બસ ખરીદવા પુરતી રકમ મળી રહે તે હેતુથી દર વર્ષના  
 અંતે અમુક રકમ સિક્કીંગ ફંડમાં 12 ટકાના ચકવુદ્ધ વ્યાજ રોકાણ કરવાનું નક્કી કરવામાં  
 આવ્યું છે. તો દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ સિક્કીંગ ફંડમાં કેટલું રોકાણ કરવું જોઈએતે રકમ  
 શોધો.
- [C] નીચેના કાર્ય- વહેચણીના પ્રક્રિયા માટે ન્યુનતમ ઉકેલ મેળવો. [08]

	કાર્ય				
		I	II	III	IV
મશીન	A	42	40	51	67
	B	57	42	63	58
	C	49	52	48	61
	D	41	45	60	55

OR

- Q.5 [A] નીચેના પદો સમજાવો. [06]  
 1. સાદુ વ્યાજ      2. એન્યુઇટિ      3. સિક્કીંગ ફંડ (પરતનિધિ).  
 [B] હિતેશભાઈએ એક કંપનીમાં રૂ 15000 નું 11% ના ચકવુદ્ધ વ્યાજ રોકાણ કર્યું છે. 5 વર્ષ પછી [06]  
 તેમને કેટલી રકમ અને કેટલું વ્યાજ મળશે?  
 [C] નીચેના કાર્ય- વહેચણીના પ્રક્રિયા માટે ન્યુનતમ ઉકેલ મેળવો. [08]

માણસો	કાર્ય				
	P	Q	R	S	T
A	6	12	11	3	5
B	4	2	7	1	10
C	8	11	10	7	11
D	16	19	12	23	21
E	9	5	7	6	10

~~Answer~~

— X —

(3)

